



DI-002-001202

Seat No. _____

B. Com. (Sem. II) (CBCS) Examination

March - 2022

Economics

(Business Economics-2)

(Old Course)

Faculty Code : 002

Subject Code : 001202

Time : **2.30** Hours]

[Total Marks : **70**

સૂચના : (1) મુદ્દાસર જવાબ આપો.

(2) દરેક પ્રશ્નના ગુણ જમણી તરફ દર્શાવેલ છે.

1 પૂર્ણ હરિકાઈવાળા બજારમાં ટૂંકાગાળામાં કિંમત નિર્ધારણ પેઢી અને ઉદ્યોગની સમતુલા સમજાવો. **20**

અથવા

1 (a) ઈજારાના પ્રકારો સમજાવો. **10**
(b) ઈજારાનાં અનિષ્ઠો ચર્ચો. **10**

2 કિંમત ભેદભાવ એટલે શું ? તે ક્યારે શક્ય અને નફાકારક બને છે ? **20**

અથવા

2 ઈજારાયુક્ત હરિકાઈ હેઠળ લાંબાગાળામાં કિંમત નિર્ધારણ તેમજ પેઢી અને જુથની સમતુલા સમજાવી સમતુલાની શરતો દર્શાવો. **20**

3 વેચાણખર્ચ એટલે શું ? વેચાણખર્ચની માગના વક્ર ઉપરની અસરો આકૃતિની મદદથી સમજાવો. **15**

અથવા

3 (a) ખાંચાવાળી માંગરેખાના સિદ્ધાંત હેઠળ કિંમત જડતા સમજાવો. **08**
(b) અલ્પહસ્તક ઈજારાનાં લક્ષણો સમજાવો. **07**

4 (a) ભાડાનો આધુનિક સિદ્ધાંત સંક્ષિપ્તમાં સમજાવો. **08**
(b) વાસ્તવિક વેતનને અસર કરતાં પરિબળો સમજાવો. **07**

અથવા

4 (a) નફાનો જોખમ અને અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો. **08**
(b) વ્યાજના દરને અસર કરતાં પરિબળો સમજાવો. **07**

ENGLISH VERSION

- Instructions :** (1) Write to the point.
(2) Mark of each questions is indicated right side.

- 1 Explain in short run price determination and an equilibrium of a firm and industry under perfect competition. **20**

OR

- 1 (a) Explain types of monopoly. **10**
(b) Discuss the evils of monopoly. **10**

- 2 What is price discrimination ? When it Possible and Profitable ? **20**

OR

- 2 Explain the long run price determination of a firm and a group under monopolistic competition and mention conditions and mention conditions of the equilibrium. **20**

- 3 What is selling cost ? Explain the impact of selling cost on demand curve with the help of diagram. **15**

OR

- 3 (a) Explain the price rigidity under the law of kinked demand curve. **08**
(b) Explain the Characteristics of Oligopolistic Competition. **07**

- 4 (a) Explain in brief the modern theory of rent. **08**
(b) Explain the factors affecting the rate of real wage. **07**

OR

- 4 (a) Explain the profit theory of risk and uncertainty. **08**
(b) Explain the factors affecting the rate of interest. **07**